

રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ

રજીસ્ટ્રેશન નંબર - ૫૧૬૭


તારીખ : ૧૮-૦૪-૨૦૧૯

વેચાણ લેનાર : કે. જી. વોરા સીક્યુરીટીઝ લીમીટેડ

વેચાણ આપનાર : શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, વિગેરે

-: સ્થાવર મિલ્કતનું વર્ણન :-

૫૬
દુકાન નંબર - ૩૬, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા,
ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા



ભરત ટી. મજમુંદાર, એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ),
ઓફીસ : ૧૦૩, શ્રીરંગ એપાર્ટમેન્ટ, ડૉ. સ્વાદીયા હોસ્પિટલની પાછળ,
કુબેર ભવન પાસે, કોઠી, વડોદરા.
મો. નં. ૯૮૨૫૦ ૨૫૩૨૮ - ઓફીસ ફોન નંબર-૦૨૬૫ - ૨૪૨૫૬૬૭

Sub-Registrar Office(SRO) Vadodara-5(Bapod)

ગામનું નામ	દસ્તાવેજનો પ્રકાર અને અલેજ (ભાડા પટાના કિસ્સામાં આકાર પટે આપનાર અથવા પટે શખનાર આપે છે તે જણાવવું)	સર્વે નંબર પેટા વિભાગ નંબર અને ઘર નંબર (જો કંઈ પણ હોય તો)	ભેટફળ	આકાર અથવા જુદી આપવામાં આવે ત્યારે તે.	દસ્તાવેજ કરી આપનાર પક્ષકર્તાનું નામ અથવા દિવાની કોર્ટના હુકમનામા અથવા આદેશના સંબંધમાં પ્રતિવાદીનું નામ	દસ્તાવેજ કરી લેનાર પક્ષકર્તાનું નામ અથવા દિવાની કોર્ટના હુકમનામા અથવા આદેશના સંબંધમાં વાદીનું નામ	સહીની તારીખ નોંધણીની તારીખ	અનુક્રમ, વોલ્યુમ અને પૃષ્ઠ નંબર	શેરો
SAVAD	માલિકી ફેરખત/વિચારણ	રે.સ.નં. 215/1/2 પેક્રી, ટી.પી.નં. 5 ના ફા.પ્લોટ.નં. 300 પેક્રીની બી.નખેતીની જમીન કે જેનું માપ 6660.00 ચોમી શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા શાઉન્ડ ફ્લોર, ફુકાનં. 34 જેનું કારપેટ એરિયાનું માપ 23.50 ચોમી છે તથા વરણે પડતી જમીન નું માપ 11.37 ચો.મી.			3. શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા પોતે જાતે તથા નં. 1,2 અને 4 ના કુ.મુ. 1. શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા 2. શ્રી મનીષભાઈ ભાદાભાઈ પાનસુરીયા 4. શ્રી કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા તમામના કુમુ નં. 3.....	કે.જી. વોરા સીક્યુરીટીઝ લીમીટેડ, એ નામની કંપની તેના વતી અધિકૃત ડાયરેક્ટર શ્રી તુષાર અમૃતલાલ જોષી	20/04/2019 20/04/2019	4987	
SAVAD	રૂ. 1292500.00								

મુકાબલ કરનાર
ખરી નકલ

ભરત દી મજમુંદાર ની તારીખ 22/04/2019 ના રોજની




અરજી નંબર : 5168

તારીખ : 22/4/19

(Signature)
સબ-રજીસ્ટ્રાર

Sub-Registrar Office(SRO) Vadodara-5(Bapod)

Sub-Registrar Office(SRO) Vadodara-5(Bapod)



નોંધ: કોમ્પ્યુટર પ્રિન્ટમાં કોઈ પણ રીતે કરેલ સુધારો માન્ય ગણાશે નહીં.

પ્રિન્ટ તારીખ : 22/04/2019





सत्यमेव जयते

INDIA NON JUDICIAL
Government of Gujarat
Certificate of Stamp Duty

BRA-5
BPD
9982 120
2019

Certificate No. : IN-GJ02849244676176R
Certificate Issued Date : 18-Apr-2019 03:18 PM
Account Reference : SHCIL (FI)/ sh-vod01/ BARODA/ GJ-BA
Unique Doc. Reference : SUBIN-GJSH-VOD0150549948974037R
Purchased by : BRIJAL PATEL
Description of Document : Article 20(a) Conveyance - Immovable Property
Property Description : MOJE SAVAD SHREE SIDDHESHWAR PLAZA SHOP GF-34
Consideration Price (Rs.) : 12,92,500
(Twelve Lakh Ninety Two Thousand Five Hundred only)
First Party : K G VORA SECURITIES LIMITED
Second Party : PRAVINBHAI BHADABHAI PANSURIYA AND OTHERS
Stamp Duty Paid By : K G VORA SECURITIES LIMITED
Stamp Duty Amount(Rs.) : 63,340
(Sixty Three Thousand Three Hundred And Forty only)



TQ 0006485155

Statutory Alert:


1. The authenticity of this Stamp Certificate should be verified at "www.shcilestamp.com". Any discrepancy in the details on this Certificate and as available on the website renders it invalid.
2. The onus of checking the legitimacy is on the users of the certificate.
3. In case of any discrepancy please inform the Competent Authority.

વેચાણ આપનાર

વેચાણ લેનાર

BRA-5
BPD
4987 2 20
2019

..1..



**RERA REGISTRATION NO.
PR/GJ/Vadodara/Vadodara/Others/
MAA02489/240418**

॥ श्री ॥

સ્થાવર મિલ્કતનો વેચાણ દસ્તાવેજ

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરાના (વિભાગ-૫) મોજે ગામ
મવાદની સીમની રેવન્યુ સર્વે નંબર-૨૧૫/૧/૨ પૈકી ૧, ૨, ૩, ૪ અને ૫,
ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૫, ફાઇનલ પ્લોટ નં. ૩૦૦ પૈકીની બીનખેતીની જમીન,
ક્ષેત્રફળ ૬૬૬૩.૦૦ ચો.મી. વાળી જમીનમાં બંધાયેલ “શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા”
નામની વ્યાપારીક તથા રહેણાંક યોજનામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાન નં. ૩૪,
કે જેના કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૨૩.૫૦ ચોરસ મીટર તથા તેને વરાડે
પડતી જગ્યાનું ક્ષેત્રફળ ૧૧.૩૭ ચોરસ મીટર છે તે મિલ્કતનો વેચાણ દસ્તાવેજ
રૂ. ૧૨,૯૨,૫૦૦/- (અંકે રૂપીયા બાર લાખ બાણું હજાર પાંચસો પુરાનો)

આજ તારીખ- ૧૮-૦૪-૨૦૧૯ ને ગુરુવારના રોજ તમો આ
વેચાણ દસ્તાવેજ,



વેચાણ આપનાર

વેચાણ લેનાર

BRA-5
BPD

4987 3 20
2019

.. 2 ..

લખી લેનાર - એક તરફવાળા :

કે. જી. વોરા સીક્યુરીટીઝ લીમીટેડ, એ નામની કંપની, કે જે ધી કંપનીઝ એક્ટ, ૧૯૫૬ હેઠળ રજીસ્ટર્ડ થયેલ કંપની છે, PAN : AABCK 1732 D, જેનું ઠેકાણું : ઓફીસ નં. ૩૦૪, ત્રીજો માળ, શ્રી મહાલક્ષ્મી રેસીડન્સી, દારુવાલા કંપાઉન્ડ ગલી, મલાડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૪, મહારાષ્ટ્ર રાજ્ય મુકામે આવેલ છે, તેના વતી અધિકૃત ડાયરેક્ટર શ્રી તુષાર અમૃતલાલ જોશી, ઉ.વ.આ. ૪૩, ધંધો - વેપાર, PAN : ABOPJ 4095 K --- AADHAAR CARD NO . 5143 2796 3369

(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો અથવા વેચાણ લેનાર અથવા એક તરફવાળા એ રીતે સંબોધવામાં આવેલા છે, સદર સંબોધનના અર્થમાં લખી લેનાર તથા તેઓના વંશ, વાલી, વારસદારો, સક્સેસરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, એટર્ની, એડમીનીસ્ટ્રેટર્સ, ઈત્યાદી તમાનો સમાવેશ થયેલો ગણવામાં આવશે)

જોગ, આ બાનાખત લખી આપનાર - બીજી તરફવાળા :

- ૧) શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, ઉ.વ.આ. ૪૨, ધંધો-વેપાર (PAN:AIPPP 9414 Q)
- ૨) શ્રી મનીષભાઈ ભાદાભાઈ પાનસુરીયા, ઉ.વ.આ. ૩૬, ધંધો-વેપાર, (PAN:AKMPP 7595 H)
- ૩) શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, ઉ.વ.આ. ૩૮, ધંધો-વેપાર, (PAN:AKOPP6830D)
- ૪) શ્રી કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા, ઉ.વ.આ. ૪૦, ધંધો-વેપાર, (PAN:AKMPP 7594 G)

નં. ૧ થી ૪ કે જેઓ સગપણમાં સગા ભાઈઓ થાય છે, જે તમામ રહેવાસી - કારેલીબાગ, વડોદરાના તે નં. ૧, ૨ અને ૪ ના કુલમુખત્યાર નં. ૩ પોતે શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, ઉ.વ.આ. ૩૮, ધંધો - વેપાર, (PAN:AKOPP6830D) કે જેમની ઓફીસ શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા, ફેઝ-૧, ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા મુકામે આવેલી છે.

(જેમને હવે પછી આ કરારમાં વેચાણ આપનાર અથવા લખી આપનાર અથવા બીજી તરફવાળા એ રીતે સંબોધવામાં આવેલા છે. સદર સંબોધનના અર્થમાં લખી આપનાર તથા તેમના વંશ, વાલી, વારસદારો, સક્સેસરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, એડમીનીસ્ટ્રેટર્સ, એટર્ની ઈત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણવામાં આવશે)

વેચાણ આપનાર



વેચાણ લેનાર

BRA-5
BPD
૫૧૪૭ ૫ ૨૦
2019

..3..

જોગ, અમો બીજી તરફવાળાની સંયુક્ત માલીકી કબ્જા ભોગવટાની સ્થાવર મિલ્કત-જમીન રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરાના (વિભાગ-૫) મોજે ગામ સવાદની સીમની રેવન્યુ સર્વે નંબર-૨૧૫૧/૨ પૈકી ૧, ૨, ૩, ૪ અને ૫, ટી. પી. સ્કીમ નં. ૫, ફાઇનલ પ્લોટ નં. ૩૦૦ પૈકીની બીનખેતીની જમીન, ક્ષેત્રફળ ૬૬૬૩.૦૦ ચો.મી. વાળી જમીન આવેલ છે. સદરહું જમીન અમોએ તેના માલીક અને કબ્જેદાર પાસેથી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અનુક્રમ-૨૦૦ તથા અનુક્રમ-૨૦૧ તથા અનુક્રમ-૨૦૨ તથા અનુક્રમ-૨૦૩ તથા અનુક્રમ-૨૦૪ થી તમામની તારીખ-૦૫-૦૨-૨૦૧૬ ના રોજથી વેચાણ રાખેલી છે. આમ, અમો સદર જમીન - મિલ્કતના કાયદેસરના માલીક બનેલ હોઈ, રેવન્યુ રેકર્ડના ગામ નમુના નંબર-૬ (હક્ક પત્રક) માં અમારુ નામ અનુક્રમે ફેરફાર નોંધ નંબર-૩૮૯૨ થી ફેરફાર નોંધ નંબર-૩૮૯૬ થી તા.૧૪-૦૩-૨૦૧૬ ના રોજથી નામ દાખલ થયેલુ છે.

આમ, સદર જમીનમાં માલીકી હક્ક અધિકાર ધરાવીએ છીએ તે રુઈએ તમોને આ વેચાણ દસ્તાવેજ કરી આપીએ છીએ.

સદર વેચાણ દસ્તાવેજના પરિશીષ્ટમાં જણાવેલ મિલ્કત અંગે તમામ બાંધકામની પ્રવૃત્તિ એસ. પી. ઈન્ફા નામની ભાગીદારી પેઢી કરનાર છે અને સદર પેઢીમાં અમો જમીન માલીકો ભાગીદાર છીએ.


પરિશીષ્ટવાળી જમીન અંગે બીન ખેતીની પરવાનગી (એન.એ. ઓર્ડર) વડોદરાના મહેરબાન કલેક્ટર સાહેબશ્રીએ તેમના હુકમ નંબર- એન.એ./ એસ.આર. /૨૧૩/ ૨૦૧૬-૨૦૧૭- નં. જમીન-ડી/ કલમ-૬૫/ વશી/ ૫૦૪૬ થી ૫૦૫૪ / ૨૦૧૬ થી તા.૨૩-૦૮-૨૦૧૬ ના રોજથી આપેલ છે.

સદર સંપુર્ણ જમીનમાં બાંધકામ માટે વડોદરા મહાનગર પાલીકાની વિકાસ પરવાનગી / રજાચીઠી નંબર-વોર્ડ -૯/૧૭૦/૨૦૧૬-૨૦૧૭ થી તા.૧૮-૧૧-૨૦૧૬ થી મેળવવામાં આવેલ છે અને ત્યારબાદ રીવાઈઝ્ડ રજાચીઠી નં. વોર્ડ-૯/૧૧૮/૨૦૧૭-૨૦૧૮ તા.૦૪-૦૯-૨૦૧૭ થી મેળવવામાં આવેલ છે.



વેચાણ આપનાર





વેચાણ લેનાર

BRA-5
BPD

૫૧૪૭ ૫ ૨૦

2019


.. 4 ..


સદર જમીન-મિલ્કત અમારી સંયુક્ત માલીકી અને કબ્જા ભોગવટાની છે. સદર મિલ્કતમાં અમારા સિવાય અન્ય કોઈનો લાગ, ભાગ, હક્ક, હિત, સબંધ, અલાખો, બોજો કે ઈઝમેન્ટના રાઈટ્સ તથા ભરણ-પોષણના હક્કો નથી તેમજ સદર મિલ્કત અંગે કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી ખાતાની જેવી કે ઈન્કમ ટેક્સ વિભાગની ટાંચ કે એટેચમેન્ટ નથી કે સદર મિલ્કત વેચાણ કરવા માટે કોઈપણ સરકારી ખાતા તેમજ ખાનગી વ્યક્તિ કે સંસ્થા તરફથી બંધન નથી તેવી બાંહેધરી આપી આ કરાર કરી આપેલો છે. સદર મિલ્કત અંગે કોઈપણ ન્યાયની કોર્ટમાં કાનુની કાર્યવાહી ચાલતી નથી અગર સદર મિલ્કત વેચાણ અગર ટ્રાન્સફર કરવા અંગે અમોએ કોઈને પણ કોઈપણ પ્રકારનું લખાણ કરી આપેલ નથી તેમજ આ મિલ્કત ઉપર કોઈનો ભરણ-પોષણનો બોજો નથી તથા કોઈ દિવાની કોર્ટની જમીમાં નથી કે અવ્વલ-જમીમાં નથી તથા કોઈને ગીરો, વેચાણ, બક્ષીસ, જામીનગીરીમાં આપી નથી. આમ, સદર જમીનના ટાઈટલ સંપૂર્ણપણે ક્લીયર અને માર્કેટેબલ છે અને તે બાબતે તમો લખી લેનાર - ખરીદનારે પુરતી અને યોગ્ય ચકાસણી કરી-કરાવી લીધેલ છે અને સદર મિલ્કતના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા અંગે પુરતી ખાત્રી અને સંતોષ તમો લખી લેનાર - ખરીદનારને થતા અમો લખી આપનાર - વેચાણ આપનારે તેવો પાકો ભરોસો વિશ્વાસ અને બાંહેધરી આપી તમોને પરિશીષ્ટ-૧ વાળી જમીનમાં બનાવેલ પરિશીષ્ટ-૨ વાળી મિલ્કત વેચાણ આપીએ છીએ.

આમ, નીચે મુજબની વિગતે બનાવેલ “શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા” નામની યોજના પૈકી પરિશીષ્ટ-૨ માં જણાવેલ મિલ્કત અમો બીજી તરફવાળા જમીન-મિલ્કતના માલીક તરફથી તમો લખી લેનારને રૂ.૧૨,૯૨,૫૦૦/- (અંકે રૂપીયા બાર લાખ બાણું હજાર પાંચસો પુરા) માં વેચાણ આપીએ છીએ અને તેનો વેચાણ અવેજ અમો બીજી તરફવાળાને નીચેની વિગતે ચેક/રોકડેથી તમારી પાસેથી ચુકતે મળી ગયેલ છે, જે પહોચ્યાનું અમો કબુલ કરીએ છીએ અને તેના બદલામાં પરિશીષ્ટ-૧ માં બનાવેલ પરિશીષ્ટ-૨ વાળી મિલ્કતનો શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબ્જો તમો એક તરફવાળા - લખી લેનારને આજરોજ આપી દીધેલ છે.



વેચાણ આપનાર





વેચાણ લેનાર

BRA-3
BPD
49876
2019

..5..

અવેજની વિગત

રકમ-રૂપીયા	ચેક નંબર	બેંકની વિગત
૬,૦૦,૦૦૦/-	આર.ટી.જી.એસ. - 19095810704	કોટક મહીન્દ્રા બેંક તારીખ-૦૫-૦૪-૨૦૧૯
૧,૯૨,૫૦૦/-	આર.ટી.જી.એસ. - KKBKR 520190409006145	કોટક મહીન્દ્રા બેંક તારીખ-૦૯-૦૪-૨૦૧૯
૫,૦૦,૦૦૦/-	આર.ટી.જી.એસ. - KKBKR 52019040900613398	કોટક મહીન્દ્રા બેંક તારીખ-૦૯-૦૪-૨૦૧૯
૧૨,૯૨,૫૦૦/-	અંકે રૂપીયા બાર લાખ બાણું હજાર પાંચસો પુરા	

સદર પરિશીષ્ટ-૨ માં વર્ણનવાળી મિલ્કત તેમાં આવેલા બાંધકામ સાથે તમોને વેચાણ આપેલ છે તથા તેને લાગતા-વળગતા તમામ પ્રકારના હક્કો સાથેની તથા તેમાં જવા-આવવાના રસ્તાના તથા પાણીના નિકાલના સર્વે પ્રકારના હક્કો સાથેની મિલ્કત ઉપર લખેલા નાણાં / વેચાણ અવેજ તમારી પાસેથી લઈને તમોને યાવતચંદ્ર દિવાકરો કુલ અભરામ ન દાવે અઘાટ વેચાણ આપી છે. તેથી સદરહુ વેચાણ આપેલ પરિશીષ્ટ-૨ વાળી મિલ્કતના આજથી તમો તથા તમારા વંશ, વાલી, વારસદારો સર્વે સ્વતંત્ર માલીક થયા છો અને તેનો માલીકી હક્કે વાપર, ઉપયોગ, ઉપભોગ કરવા તથા તે ગીરો, વેચાણ, બક્ષીસ કરવા તમો તથા તમારા વંશ, વાલી, વારસદારો સર્વે સ્વતંત્ર માલીક થયા છો અને હવે આ મિલ્કત સાથે અમો કે અમારા વંશ, વાલી, વારસદારોનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિત કે સંબંધ રહ્યો નથી.

આ વેચાણ દસ્તાવેજથી તમોને વેચાણ આપેલી મિલ્કત આ વેચાણ દસ્તાવેજના આધારે તમો સરકારી કચેરીમાં, વડોદરા મહાનગર સેવા સદનમાં, મધ્ય ગુજરાત વીજ કંપની લી. ની કચેરીમાં, વડોદરા ગેસ લીમીટેડની કચેરીમાં તેમજ અન્ય તમામ સરકારી તથા અર્ધ-સરકારી કચેરીમાં તમારા નામ ઉપર કરાવી લેવાને હક્કદાર થયા છો અને તેમાં અમારી સહી, સંમતીની જ્યારે જરૂર પડે ત્યારે તેવી સહી-સંમતી અમો તમોને ફરી આપીશું.

વેચાણ આપનાર



વેચાણ લેનાર

BRA-5
BPD

૫૧૬૭ ૭ ૨૦

2019

..6..

જમીનનું પરિશીષ્ટ-૧

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરાના (વિભાગ-૫) મોજે ગામ સવાદની સીમની રેવન્યુ સર્વે નંબર-૨૧૫/૧/૨ પૈકી ૧, ૨, ૩, ૪ અને ૫, ટી. પી. સ્કીમ નં. ૫, ફાઈનલ પ્લોટ નં. ૩૦૦ પૈકીની બીનખેતીની જમીન, ક્ષેત્રફળ ૬૬૬૩.૦૦ ચો.મી. વાળી જમીન આવેલ છે. સદર જમીનમાં “શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા” નામની યોજનાનું આયોજન કરેલ છે. આમ, જરૂરી પરવાનગીઓ મેળવી મંજૂર થયેલા નક્શા - પ્લાન મુજબ તેમજ બીનખેતીના તમામ નિયમોને ધ્યાનમાં રાખી સદર જમીનમાં દુકાનો તથા ફ્લેટ્સ બાંધવાનું આયોજન કરેલ છે, તે પૈકી ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલ “દુકાન નંબર-૩૪” જેનું વિગતવાર વર્ણન નીચે જણાવેલ છે તે મિલ્કત સદર વેચાણ દસ્તાવેજથી તમોને વેચાણ આપવાનું નક્કી કરેલ છે.

વેચાણ દસ્તાવેજ હેઠળની મિલ્કતનું પરિશીષ્ટ-૨

ફ્લોર	દુકાન નંબર	કાર્પેટ એરીયાનું માપ (ચો.મી.)	વરાડે પડતુ કોમન માપ (ચો.મી.)
ગ્રાઉન્ડ	૩૪	૨૩.૫૦	૧૧.૩૭

વેચાણ આપેલ મિલ્કતની ચતુ:સીમા નીચે મુજબ છે :

પુર્વે : બેઝમેન્ટ પાર્કીંગ રેમ્પ આવેલ છે.

પશ્ચિમે : કોમન પેસેજ આવેલ છે.

ઉત્તરે : દુકાન નં. ૩૩, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા આવેલ છે.

દક્ષિણે : દુકાન નં. ૩૫, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા આવેલ છે.

૨૨

વેચાણ આપનાર



૨૨

વેચાણ લેનાર

BRA-5
BPD
૫૧૪૭ ૪ ૨
2019

..7..

સદર બિલ્ડીંગ ફ્લેટ પદ્ધતીથી બાંધેલી હોઈ તેની કેટલીક શરતો નીચે મુજબ છે :

- (૧) આ વેચાણ દસ્તાવેજમાં જણાવેલી મિલ્કત ફ્લેટ પદ્ધતીથી બાંધેલી હોઈ તેની જે જે કોમન સર્વિસ હશે તે તમોને મળશે અને તેના અંગે જે જે કોમન ચાર્જ હશે તો તે તમારે આપવાના રહેશે અને સદર મિલ્કતનું જે એસોસીએશન બનાવવામાં આવે તેમાં તમારે ફરજિયાત દાખલ થવાનું છે અને તેના નિતી-નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે તથા જે કાંઈ ફી હશે તો તે તમારે આપવાની રહેશે તેના ઉપર આ દસ્તાવેજનો આધાર છે.
- (૨) સદર બિલ્ડીંગ / ઈમારતનો જે નક્શો મંજૂર કરેલો છે તેના એલીવેશનમાં કોઈપણ સુધારો, વધારો કરવાનો નથી.
- (૩) અમો વેચાણ આપનાર જે તે પ્રમાણે વેચાણ કરીએ તે રીતે તેનો વાપર, ઉપયોગ કરવાનો છે, તેમાં બીજા કોઈ સભ્યએ વાંધો લેવાનો નથી કે તકરાર કરવાની નથી.
- (૪) સદર બિલ્ડીંગને ગુજરાત ઓનરશીપ એક્ટ, ૧૯૬૪ લાગુ પડે છે. સદર બિલ્ડીંગ કુદરતી કે માનવસર્જિત કારણોસર જમીનદોસ્ત થાય તો સદર બિલ્ડીંગની ભોયતળીયાની જમીન પર તમારી મિલ્કતના લખેલા માપ જેટલો તમારો અધિકાર રહેશે તથા આ બિલ્ડીંગના ભોયતળીયાની જમીન સદર બિલ્ડીંગના તમામ સહભાગીદારોની સહીયારી છે અને રહેશે.
- (૫) તમોને જે મિલ્કત વેચાણ આપી છે તે બિલ્ડીંગનું હાલ બાંધકામ ચાલુ છે. એટલે કામમાં કોઈ અંતરાય, રુકાવટ કે મજૂર કે માલ-સામાન વિગેરેની જવા-આવવા લઈ જવામાં કોઈ રુકાવટ કરવાની નથી.
- (૬) તમોને જે મિલ્કત વેચાણ આપી છે તેની આજુબાજુની દીવાલો તથા ઉપર નીચેના સ્લેબ સહીયારા રહેશે. તમોને જે મિલ્કત વેચાણ આપી છે તેટલી મિલ્કતના માપ સિવાય બાકીની મિલ્કતમાં તમારો કોઈ હક્ક કે અધિકાર રહેશે નહીં એટલે કે ચાર દિવાલો વચ્ચેની મિલ્કતની માલિકી તમારી રહેશે.

વેચાણ આપનાર



વેચાણ લેનાર

BPD
 ૫૧૪૭ ૧ ૨૦
 2019

- (૭) સદર બિલ્ડીંગમાં માર્જનવાળી જગ્યામાં તમામ ફ્લેટના માલીકો-સભાસદોના સંયુક્ત હક્ક રહેશે. સદર માર્જનની જગ્યાનો ઉપયોગ તમામ ફ્લેટના માલીકો-સભાસદ કરી શકશે. પરંતુ, દુકાન-ઓફીસના સભાસદે સદર માર્જનની જગ્યાનો તેમજ રહેણાંક માટે બનાવેલ કોમન પ્લોટ તેમજ કોમન એમેનીટીઝનો વાપર ઉપયોગ કે ઉપભોગ કરવાનો નથી, તેને વેચાણ, ગીરો, ભાડે કોઈપણ સભાસદ આપી શકશે નહીં, તેવી સ્પષ્ટતા સાથે આ વેચાણ દસ્તાવેજમાં અમો લખી આપનારે સહી કરી છે.
- (૮) સદર મિલ્કતના તમામ સભાસદોએ ભવિષ્યમાં જે જે સરકારી, અર્ધ-સરકારી ભરણા ટેક્ષ, વડોદરા મહાનગર સેવા સદનના વેરા, તેમજ વહીવટી ખર્ચ, એમ.જી.વી.સી.એલ. મીટર ડીપોઝીટ ખર્ચ, જમીનની મહેસુલ ખર્ચ વિગેરે નિયત દરો વખતો વખતના નિયમો મુજબ જે કાંઈ ભરવાના આવશે તો તે તમામ રકમ તમો લખી લેનારે ભોગવવાની / ભરવાની રહેશે. વહીવટી ખર્ચ સદર સ્કીમના તમામ સભાસદોએ આપવાનો રહેશે તે રીતે તમારે પણ તમારા વરાડે આવતો હીસ્સો આપવાનો રહેશે.
- (૯) સદર પરિશીષ્ટ-૨ વાળી મિલ્કતનો કબ્જો તમો એક તરફવાળાએ સ્વીકારી લીધા બાદ મિલ્કતને વરસાદી પુર, ભુકંપ, કુદરતી કે વિદ્યુતને લીધે લાગેલી આગ, વીજળી ત્રાટકવી તથા અન્ય કોઈપણ કૃત્રિમ કે કુદરતી આફતથી થયેલ જાનહાની કે અન્ય કોઈપણ પ્રકારના નુકશાન માટે ડેવલપર્સની જવાબદારી રહેશે નહીં અને તમો એક તરફવાળા એ બાબતમાં ભવિષ્યમાં પણ ક્યારેય અમો બીજી તરફવાળા આ વેચાણ દસ્તાવેજ લખી આપનાર સાથે વાદ-વિવાદ કે તકરાર કરશો નહીં તે શરત સાથે તમો લખી લેનાર એક તરફવાળાને આ વેચાણ દસ્તાવેજ લખી આપેલ છે.
- (૧૦) તમોને વેચાણ આપેલી મિલ્કતની આજુબાજુના પેસેજ, દાદર વિગેરેમાં ગંદકી થાય કે કોઈને અડચણરુપ થાય તેવું કોઈ કૃત્ય કરવાનું નથી. તમોને વેચાણ આપેલ મિલ્કત તથા ઈમારતમાં સરકારી કાયદા વિરુદ્ધ કોઈ માલસામાન રાખવાનો નથી કે તેવો કોઈ ધંધો કરવાનો નથી તથા સળગી ઉઠે તેવો કોઈ સ્ફોટક પદાર્થ રાખવાનો નથી.



વેચાણ આપનાર



વેચાણ લેનાર

BRA-5
BPD
૨૦૧૭ ૧૦ ૨૦
2019

- (૧૧) તમોને વેચાણ આપેલી મિલ્કતની ઈમારતના કોમન દાદર, પેસેજ તથા રસ્તા અંગે તથા ઈમારતના મેન્ટેનન્સ અંગે જે કોઈ ખર્ચ થાય તે બધા સભાસદોએ સહીયારો આપવાનો રહેશે અને તે પ્રમાણે તમો વેચાણ લેનારે પણ આપવાનો રહેશે.
- (૧૨) સદર ઈમારતમાં રહેણાંક માટે ઉપર-નીચે પાણીની ટાંકી છે તેમાંથી બધાને પાણી મળશે અને તે અંગે જે મોટર પંપ કે તેની લાઈનો જે કાઈ મુકવામાં આવે તેના નિભાવણી ખર્ચ તથા લાઈટ બીલ વિગેરેનો ખર્ચ તથા નવીન નાંખવાનો ખર્ચ બધાએ વરાડે પડતો આપવાનો રહેશે તે પ્રમાણે તમો વેચાણ લેનાર પણ વરાડે પડતો આપવાનો છે.
- (૧૩) સદર ઈમારતમાં સીક્યુરીટી અંગે કોઈ સીક્યુરીટી ગાર્ડ રાખવામાં આવે તો તેનો પગાર વિગેરેનો ખર્ચ બધાએ વરાડે પડતો આપવાનો છે તે પ્રમાણે તમો વેચાણ લેનારે પણ વરાડે પડતો આપવાનો છે.
- (૧૪) સદર “શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા” નામની યોજનાના રહીશો-માલીકો કોઈ એસોસીએશન બનાવે તે એસોસીએશનમાં તમારે ફરજિયાત દાખલ થવાનું રહેશે, જે સદર કોમ્પલેક્ષના નિભાવણી ખર્ચ માટે જે કોઈ ભંડોળ ઉઘરાવવાનું નક્કી થશે તે તમો વેચાણ લેનારે પણ આપવાનું રહેશે, જે આ દસ્તાવેજની મુખ્ય શરત છે.
- (૧૫) સદર પરિશીષ્ટ-૧ વાળી મિલ્કતમાં ભવિષ્યમાં વધારાની એફ.એસ.આઈ. મળે તો તમોને વેચાણ આપેલી મિલ્કત જે ઈમારતમાં આવેલ છે તે ઈમારતના ફાઉન્ડેશનમાં કોલમ દિવાલો વિગેરેના સહારો લઈ બાકીનું બાંધકામ અમો કરી શકીશુ તથા નળ, લાઈટ, ડ્રેનેજ વિગેરેના જોડાણો મેઈન લાઈનમાંથી લઈ શકીશુ તે અંગે તમો વેચાણ લેનારે અમો વેચાણ દસ્તાવેજ લખી આપનાર સાથે કોઈપણ જાતની તકરાર કરવાની નથી અને નવીન સભ્યોનો કોમન, માર્જીન વાળી જગ્યામાં સહીયારો હક્ક રહેશે.
- (૧૬) સદર તમોને વેચાણ આપેલી મિલ્કત જે ઈમારતમાં આવેલ છે તે ઈમારતનું બાંધકામ પુરુ થાય ત્યારબાદ અમો આ વેચાણ દસ્તાવેજ લખી આપનારા સદર યોજનાના આયોજકો દ્વારા પાર્કીંગ વાપરવાની સુચના આપેથી તમો પાર્કીંગનો ઉપયોગ કરી શકશો.



વેચાણ આપનાર



વેચાણ લેનાર

BRA-5
BPD
11
2019

.. 10 ..

સદર યોજનામાં આવેલ રહેણાંક દરેક ટાવર્સના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં ફક્ત ફ્લેટસના સભાસદો પોતાના વ્હીકલ્સ પાર્ક કરી શકશે, દુકાનના સભાસદે પોતાનું વ્હીકલ બેઝમેન્ટમાં પાર્ક કરવાનું રહેશે.

(૧૭) સદર ઈમારતના બાંધકામ બાબતે તમોને સંપુર્ણ જાણકારી આપેલ હોઈ તે બાબતે તમારે કે અન્ય સભ્યોએ એકજુથ થઈ કોર્ટ / સંસ્થા દ્વારા ભવિષ્યમાં અમો વેચાણ દસ્તાવેજ લખી આપનારા સામે કોઈ પણ પ્રકારની તકરાર કરવાની રહેશે નહીં.

(૧૮) સદર મિલ્કતના ટાઈટલ અંગેના તમામ કાગળો તથા રજાચીટ્ટી વિગેરે તમામ સદર બાબતના જાણકાર તજજ્ઞ પાસે તમો લખી લેનારે ચેક કરાવી લીધેલ છે અને તે બાબતે તમોને સંપુર્ણ સંતોષ હોઈ સદર મિલ્કત તમોએ વેચાણ લીધેલ છે અને સદર વેચાણ દસ્તાવેજમાં તમોએ તમારી સહી અને અંગુઠાનું નીશાન કરેલ છે.

(૧૯) સદર યોજના રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ ની જોગવાઈઓને આધીન નોંધાયેલ છે, જેનો નોંધણી નંબર - PR/GJ/Vadodara/Vadodara/Others/MAA02489/240418 છે.

આ વેચાણ દસ્તાવેજનો સ્ટેમ્પ, નોંધણી ફી, લખાઈ ફી વિગેરે તમામ ખર્ચ તમો લખી લેનાર એક તરફવાળાએ ભોગવેલ છે અને ભવિષ્યમાં હાલ પ્રવર્તમાન સ્ટેમ્પ એક્ટના કાયદા મુજબ વધારાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે તો તે રકમ ભરવાની સંપુર્ણ જવાબદારી તમો વેચાણ રાખનાર એક તરફવાળાની છે અને રહેશે.

સદર વેચાણ દસ્તાવેજ અમો લખી આપનારાએ તમો લખી લેનારને રાજીખુશીથી, સમજી, વિચારી, વાંચી-વંચાવી, વાકેફ થઈ, બીન કેફ હાલતમાં કરી આપેલ છે, જે અમો આ કરાર લખી આપનારને તથા અમારા વંશ, વાલી, વારસદારો, એટર્નીઓ, એસાઈનીઓ, ઈત્યાદી તમામને કબુલ મંજૂર છે.

PPS

વેચાણ આપનાર



Handwritten signature of the buyer.

વેચાણ લેનાર

BRA-5
BPD
૫૧૪૭ 12 2
2019

.. 11 ..

સદર વેચાણ દસ્તાવેજ આજ તા. ૧૮-૦૪-૨૦૧૯ ના રોજ આપણે પક્ષકારો વચ્ચે વડોદરા મુકામે કરવામાં આવેલ છે.

સહી

લખી આપનાર - બીજી તરફવાળા :

- ૧) શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા
 - ૨) શ્રી મનીષભાઈ ભાદાભાઈ પાનસુરીયા
 - ૩) શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા
 - ૪) શ્રી કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા
- ઉપરોક્ત પૈકી નં. ૩ પોતે તથા
નંબર-૧, ૨ અને ૪ ના તર્ફે કુલમુખત્યાર



શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા

સાક્ષીની સહી :

- ૧) M. R. G. P. B.
- ૨) T. P. B.





BRA-5
BPD


4987 13 2

0.12..

2019

वेयाण हस्तावेजथी वेयाण आपेल स्थावर भिळ्कतना झोटोग्राफ

दुकान नं. 38, ग्राउन्ड फ्लोर, श्री सिद्धेश्वर प्लाजा,
न्यु वी.आर्.पी. रोड, वडोदरा



वेयाण आपनार

वेयाण लेनार

BRA-5
BPD
13..
187/14/20
2019

રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ ની કલમ-૩૨ (એ) મુજબનું શિડ્યુલ

વેચાણ દસ્તાવેજ લખી લેનાર :



કે. જી. વોરા સોફ્ટ્યુરીટીઝ લીમીટેડ
વતી તેના અધિકૃત ડાયરેક્ટર
શ્રી તુષાર અમૃતલાલ જોશી



વેચાણ દસ્તાવેજ લખી આપનાર :

- ૧) શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા
 - ૨) શ્રી મનીષભાઈ ભાદાભાઈ પાનસુરીયા
 - ૩) શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા
 - ૪) શ્રી કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા
- ઉપરોક્ત પૈકી નં. ૩ પોતે તથા
નંબર-૧, ૨ અને ૪ ના તર્ફે કુલમુખત્યાર



શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા





વેચાણ આપનાર



વેચાણ લેનાર

BRA-5
BPD
4987 15 20
2019

વેચાણ દસ્તાવેજ વિગેરે લેખ વખતે લખી આપનાર તથા સાક્ષીઓ માટેની પ્રશ્નોત્તરી

- : પરિશીષ્ટ :-

નોંધણી અધિનિયમ, ૧૯૦૮ ની કલમ-૩૪ ની પેટા કલમ-૩ મુજબનું ચેકલીસ્ટ
રજીસ્ટ્રેશન સીરીયલ નંબર - 4987 ... તારીખ - ૧૮-૦૪-૨૦૧૯

અ.નં.	પ્રશ્ન	જવાબ (હા કે ના)
લખી આપનાર, સંમતિ આપનાર કે તેઓના કુલમુખત્યારને પુછવાના પ્રશ્નો :		
૧)	લેખમાં દર્શાવ્યા મુજબ રજીસ્ટ્રેશન ડીસ્ક્રીક્ટ તથા સબ-ડીસ્ક્રીક્ટ વડોદરાના મોજે ગામ સવાદની સીમના રેવન્યુ સર્વે નંબર-૨૧૫/૧/૨ પૈકી ૧, ૨, ૩, ૪ અને ૫, ટી. પી. સ્કીમ નં. ૫, ફાઈનલ પ્લોટ નં. ૩૦૦ પૈકીની બીનખેતીની જમીન, ક્ષેત્રફળ ૬૬૬૩.૦૦ ચો.મી. વાળી જમીન આવેલ છે. સદર જમીનમાં “શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા” નામની યોજનાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નં.૩૪ વાળી બીનખેતીની મીલકતનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે ?	હા
૨)	લેખમાં દર્શાવ્યા મુજબ મિલકતનું કાર્પેટ એરીયાનું ક્ષેત્રફળ ૨૩.૫૦ ચોરસ મીટર વાળી બીનખેતીની મિલકત માટે લેખ કરી આપેલ છે ?	હા
૩)	લેખમાં દર્શાવ્યા મુજબની અવેજની રકમ મળેલ છે ?	હા
૪)	લેખમાં દર્શાવેલ વિગતો વાંચી, વંચાવીને, સમજી, વિચારીને તમે પોતે જાતે જ સહી / અંગુઠાની છાપ કરેલ છે તે તમે કબુલ રાખો છો ?	હા
૫)	પાવર ઓફ એટર્ની આપનાર દસ્તાવેજની તારીખે હયાત છે ?	લાગુ મહત્તુ નથી હા
૬)	પાવર ઓફ એટર્નીના લેખમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ / ઓ એ સહી / અંગુઠાનું નિશાન કરેલ છે ?	લાગુ મહત્તુ નથી હા
૭)	પાવર ઓફ એટર્નીનો લેખ દસ્તાવેજની તારીખે અમલમાં છે ?	લાગુ મહત્તુ નથી હા
૮)	ઓળખાણ આપવા સારુ તમને ઓળખતા હોય તેવી વ્યક્તિઓ સાથે લાવ્યા છો ?	હા
ઓળખાણ આપનારને પુછવાના પ્રશ્નો :		
૧)	દસ્તાવેજ લખી આપનાર વ્યક્તિ / ઓ કે જેઓએ કબુલાત આપી તેઓને તમે જાતે ઓળખો છો ?	હા
૨)	દસ્તાવેજમાં લખેલ નામ અને કબુલાત આપનાર વ્યક્તિ / ઓ એક જ છે ?	હા
૩)	કોઈ વ્યક્તિએ ખોટું નામ ધારણ કરીને કબુલાત આપી નથી એવી તમે ખાતરી આપો છો ?	હા

લખી આપનાર ની સહી

[Signature]

ઓળખાણ આપનારની સહી


[Signature]

M. R. Patel

(સહી)

સબ-રજીસ્ટ્રારશ્રી :

[Signature]



BRA/5/BPD

4987

16

20

2019

20/04/2019 1:15 PM

અનુક્રમ નંબર ૪૯૮૭ સને ૨૦૧૯ ના એપ્રિલ માસની ૨૦ મી તારીખે ૧૨ થી ૧૩ વાગ્યાની વચ્ચે વડોદરા - ૫ બાપોદ સબ રજીસ્ટ્રારની કચેરીમાં રજુ કર્યો.

પહોંચ નંબર:૨૦૧૯૩૧૫૦૧૦૩૪૨

ફીપહોંચી છે તે

Rs.

રજીસ્ટ્રેશન ફી

૧૨૯૩૦.૦૦

નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો (૨૦)

૨૦૦.૦૦

અન્ય ફી

૦.૦૦

કુલ એકંદરે રૂ.

૧૩૧૩૦.૦૦



૩. શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા પોતે જાતે તથા

નં. ૧,૨ અને ૪ ના કુ.મુ.

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

સબ રજીસ્ટ્રાર
વડોદરા - ૫ બાપોદ

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

સબ રજીસ્ટ્રાર
વડોદરા - ૫ બાપોદ

અનુક્રમ નંબર પક્ષકારનું નામ અને સરનામું

ઉંમર

ફોટોગ્રાફ

ડા.હા.અં.ની છાપ

સહી

એપ્રિલ

૩. શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા પોતે જાતે

૩૮

તથા નં. ૧,૨ અને ૪ ના કુ.મુ.

૧. શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા

૨. શ્રી મનીષભાઈ ભાદાભાઈ પાનસુરીયા

૪. શ્રી કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા

તમામના કુમુ નં. ૩.....

શ્રી સિદ્ધેશ્વર પ્લાઝા,

ન્યુ વી આઈ પી રોડ

વડોદરા.

PANNO:AKOPP6830D



દસ્તાવેજ લખી આપનાર આ દસ્તાવેજ
લખી આપ્યાનું કબુલ કરે છે.



BRA/5/BPD

4987

17

20

2019

(W) 20/04/2019 1:15 PM

૧ તુષાર અમીન
દંતેશ્વર
વડોદરા



૨ મનીષભાઈ આર પરીખ
આજવા રોડ
વડોદરા.



તેઓ કહે છે કે સદરહું લખી આપનારને તેઓ જાતે ઓળખે છે.
અને તેમની ઓળખાણ આપે છે.

૧.

૨.

મનીષભાઈ આર પરીખ

તારીખ: ૨૦ માહે: એપ્રિલ -૨૦૧૯

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

સબ રજીસ્ટ્રાર
વડોદરા - ૫ બાપોદ



બજાર કિંમત નક્કી કરવા અંગેનું ફોર્મ નં. ૧
રજુ થયેલ છે.

તારીખ: 20/04/2019

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

સબ રજીસ્ટ્રાર
વડોદરા - ૫ બાપોદ



(W) 20/04/2019 1:15 PM

BRA/5/BPD		
4987	18	20
2019		

ઉકમટેક્સ રૂલ્સ ૧૯૬૨ ની જોગવાઈ મુજબ (૧) પાન નં/ઇ.જ.ર. નંબર દર્શાવેલ છે. જેની ખરાઈ કરવામાં આવેલ છે.

આપનાર નંબર 1
લેનાર નંબર 1
સંમતી આપનાર નંબર

તારીખ: 20/04/2019

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

સબ રજીસ્ટ્રાર
વડોદરા - 5 બાપોદ

આ સાથે લેનાર , આપનાર તથા ઓળખાણ આપનારના ઓળખ અંગેના પ્રમાણિત પુરાવા રજૂ કરેલ છે.

તારીખ: 20/04/2019

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA


સબ રજીસ્ટ્રાર
વડોદરા - 5 બાપોદ

કુલ મુખત્યારનામાની પ્રમાણિત નકલ રજૂ કરેલ છે.

તારીખ: 20/04/2019

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

સબ રજીસ્ટ્રાર
વડોદરા - 5 બાપોદ



(V) 20/04/2019 1:15 PM

BRA/5/BPD		
4987	19	20
2019		

પરિપત્ર ક્રમાંક: ઈજર/વહટ/૩૪૭/૨૦૧૪/૧૩૦૦૧ થી ૧૩૩૬૪

નોંધણી સર નિરક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગરના તા.૨૨/૦૫/૨૦૧૫ ના પરિપત્ર
ક્રમાંક : ઈજર/વહટ/૩૪૭/૨૦૧૪/૧૩૦૦૧ થી ૧૩૩૬૪ તથા તા.૧૧/૧૧/૨૦૧૬
ના પરિપત્ર ક્રમાંક : ઈજર/વહટ/૩૪૭/૨૦૧૪/૩૨૩૯૨ થી ૩૨૭૫૭ મુજબ લખી આપનાર નં (1)
ને દસ્તાવેજોની વિગતે સમજૂત કર્યા અને ઓળખાણ આપનારાઓએ તેઓની
ઓળખ ખાતરી આપતા સ્થિતિશન એક્ટ -૧૯૦૮ ની કલમ -૩૪,૩૫,૫૮ અને ૫૯
હેઠળની કાર્યવાહી પુરી કરી.


KAUSHIKKUMAR MAFATLAL VANSOLA
સબ રજીસ્ટ્રાર
વડોદરા - 5 બાપોદ



(W) 20/04/2019 6:41 PM

BRA/5/BPD		
4987	20	20
2019		

१ नंवरनी भुक्रना ४८८७ नंवर नोध्यो छे.
तारीख: 20-04-2019

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA

सभ रजिस्ट्रार
वडोदरा - 5 बापोड



TRUE COPY

Y. K. DESAI
NOTARY (Govt. of India)

રજીસ્ટ્રેશન પહોંચ

પહોંચ નંબર ૨૦૧૯૩૧૫૦૧૦૩૪૨ દસ્તાવેજ નંબર ૪૯૯૭ દસ્તાવેજ વર્ષ ૨૦૧૯
તારીખ ૨૦ માહે એપ્રિલ સને ૨૦૧૯

દસ્તાવેજનો પ્રકાર: માલિકી ફેરખત/વેચાણ અવેજ ૧૨૯૨૫૦૦.૦૦
રજુ કરનારનું નામ ૩. શ્રી પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા પોતે જાતે તથા નં. ૧,૨ અને ૪ ના કુ.મુ.
નીચે પ્રમાણે ફી પહોંચી રૂ. પૈસા

રજીસ્ટ્રેશન ફી..... ૧૨૯૩૦.૦૦
નકલ કરવા ની ફી સાઈડ / ફોલીયો..... ૨૦૦.૦૦
શેરોની નકલ કરવા માટે ફી.....
ટપાલ ખર્ચ.....
નકલો અથવા ચાદીઓ (કલમ ૬૪ થી ૬૭).....
શોધ અગર તપાસણી.....
દંડ કલમ-૨૫.....
કલમ-૩૪ (કલમ-૫૭).....
નકલ ફી ફોલીયો.....
ઈન્ડેક્સ-૨ ફી



કુલ એકંદરે રૂ. ૧૩૧૩૦.૦૦

અંકે રૂપીયા તેર હજાર એક સો ત્રીસ પુરા

દસ્તાવેજ ના દિવસે તૈયાર થશે અને તે રજીસ્ટર ટપાલથી મોકલવામાં આવશે.

નકલ

કચેરીમાં આપવામાં

દસ્તાવેજ રજીસ્ટર ટપાલથી નીચેના સરનામે મોકલશો.

શ્રી સિદ્ધેશ્વર પ્વાજા,
ન્યુ વી આઈ પી રોડ
વડોદરા.

અસલ દસ્તાવેજ મળેલ છે

મો.નં.:
સહી:

અગર

ને આપશો

KAUSHIKKUMAR MAFATLAL VANSOLA
સબ રજીસ્ટ્રાર
વડોદરા ૫ બાપોદ

રજુ કરનારની સહી



TRUE COPY
Y. K. DESAI
NOTARY (Govt. of India)